



HDR-001-016304

Seat No. \_\_\_\_\_

**M. A. (Sem. III) (CBCS) Examination**

November / December – 2017

**HEC-03 : History : Paper - 14**

*(Economics history of India)*

*(Old Course)*

**Faculty Code : 001**

**Subject Code : 016304**

Time :  $2\frac{1}{2}$  Hours]

[Total Marks : 70

સૂચના : દરેક પ્રશ્નના ગુણ સરખા છે.

- ૧ ૧૯મી સદીમાં બ્રિટીશ હિંદમાં પ્રવૃત્તી જમીન મહેસુલ પદ્ધતિઓનું વિવેચન કરો. ૧૪  
અથવા
- ૧ બ્રિટીશ યુગ દરમ્યાન હિંદમાં ગૃહ ઉદ્યોગોના પતનના કારણોની સમીક્ષા કરો. ૧૪
- ૨ હિંદમાં ખેતીના વાણિજ્યકરણ માટે જવાબદાર કારણો અને પરિણામોની ચર્ચા કરો. ૧૪  
અથવા
- ૨ હિંદમાં સહકારી ચળવળનો વિકાસ આલેખો. ૧૪
- ૩ બ્રિટીશ યુગ દરમ્યાન હિંદમાં પહેલા દુષ્કાળોનું સ્વરૂપ અને કારણો દર્શાવો. ૧૪  
અથવા
- ૩ બ્રિટીશ યુગ દરમ્યાન હિંદમાં પહેલા દુષ્કાળો અંગે સરકારની નીતિઓની સમીક્ષા કરો. ૧૪
- ૪ હિંદમાં વસતી વધારાના કારણો દર્શાવી તેની અસરો તપાસો. ૧૪  
અથવા
- ૪ હિંદમાં રેલ્વેનો ઉદય, વિકાસ અને અસરો તપાસો. ૧૪
- ૫ નીચેનામાંથી ગમે તે બે પર નોંધ લખો : ૧૪  
(૧) ૧૯મી સદી દરમ્યાન હિન્દના અર્થતંત્રના મુખ્ય લક્ષણો  
(૨) કૃષિ અંગેનું શાહી પંચ  
(૩) ઈ.સ. ૧૯૪૩ નો બંગાળ દુષ્કાળ  
(૪) જળ વ્યવહારનો ઉદ્ભવ અને વિકાસ.

## ENGLISH VERSION

**Instruction :** All questions carry equal marks.

1 Critically examine the different land revenue systems prevailing in 19<sup>th</sup> Century in the British India. 14

**OR**

1 Review the causes of the decline of the handicrafts industries in India during the British Period. 14

2 Discuss the causes and results responsible for the commercialization of agriculture in India. 14

**OR**

2 Trace the development of Co-operative movement. 14

3 Trace the nature and causes of famines in India during British rule. 14

**OR**

3 Review the government policy of famines in British India. 14

4 Point out the causes of the growth of population of India and examine its effects. 14

**OR**

4 Trace the origin development and effects of Railway in India. 14

5 Write short note : (any two) 14

(1) Main features of the Indian economy during the 19<sup>th</sup> Century.

(2) Royal commission on agriculture (1926)

(3) Famines of Bengal - 1943 A.D.

(4) The origin and development of water transport.